

પાઠ ૩ ભારતના ઘર ઘરની કથા

રામાયણ



વાલ્મીકિ નામે ભારતના એક મહાન ઋષિ થઈ ગયા. એક દિવસ સવારે તમસા નદીમાં સ્નાન કરીને તેઓ જ્રાડ નીચે બેઠા હતા. ધ્યાન કરવા જતા હતા ત્યાં જ તેમની નજર જ્રાડની એક ડાળ ઉપર પડી. બે પંખીઓ એકબીજામાં મળ્ણ હતા. અચાનક એક પારધીના બાણથી એક પંખી વીધાઈ ગયું અને નીચે પડ્યું! બીજું પોતાના પ્રિયજનના આવા કરુણ મૃત્યુથી અતિ દુઃખી બનીને ચીસ પાડી ઉઠ્યું. આ દૃશ્યથી અને ચીસથી દ્યાળું વાલ્મીકિનું છદ્ય રડી ઉઠ્યું અને તેમના મુખમાંથી પારધી માટે શાપ સરી પડ્યો: "હે પારધી, આ જીવના પંખીની જેમ તું પણ અનંત કાળ સુધી સ્વજનના વિયોગ પામીશ." પણ તે શાપના શબ્દો જે રીતે ગોઠવાઈ ગયા તેનાથી ઋષિને આશ્વર્ય થયું. સંસ્કૃત ભાષાનો તે પ્રથમ શલોક બન્યો. ઋષિના અંતર્જા શોકમાંથી પવિત્ર શલોક થયો! ઋષિને થયું કે આવા સુંદર શલોકથી કોઈ મહાપુરુષની ગાથા ગાવી જોઈએ.

તે અરસામાં નારદમુનિ તેમના આશ્રમમાં આવેલા. વાલ્મીકિએ પૂછ્યું, "હે નારદમુનિ, અત્યારે મનુષ્યોમાં કોણ આતીશય ગુણવાન છે? કોણ એવા જ્ઞાની છે કે જેને સંપત્તિમાં અને વિપત્તિમાં સમાન ભાવ રહે છે? જે અતિ બળવાન છે છતાં જેને પોતાના બળનું માન નથી; અને જે બળથી પોતાની ઈન્દ્રિયો અને સમાજના દુષ્ટોનું દમન કરે છે? ઉત્તમ ત્યાગ અને સંયમવાળો કોણ છે?"

નારદજીએ કહ્યું, "આજના યુગમાં એવા સદગુણોથી તો કેવળ એક શ્રી રામયંત્ર શાખે છે! તેઓ અયોધ્યાના રાજા દશરથના પુત્ર છે. એવા ગુણવાન પુરુષની ગાથા ગાવાથી જીવનમાં શાંતિ અને આનંદ રહેશે." વાલ્મીકિએ પોતાના મનની શાંતિ માટે રાજા રામના ચરિત્રાનું ગાન સંસ્કૃતના શલોકોમાં કર્યું. તે ગ્રંથ એટલે રામાયણ. આથી મહર્ષિ વાલ્મીકિ ભારતના આદિકવિ કહેવાય છે. રામાયણ એક મહાકાવ્ય છે, તેમાં હજારો શલોકો દ્વારા શ્રી રામની કથા કહેવામાં આવી છે.

રાજા રામ એ રાવણ જેવા અસુરોનો નાશ કરવા આવેલા વિષ્ણુનો અવતાર હતા. રામાયણમાં ભગવાન રામના બાળચરિત્રાં, ઋષિઓના આશ્રમમાં તેમનો વિદ્યા અભ્યાસ, મુનિઓની સેવા, યુવાનીની શૂરવીરતાસીતા સાથે લગ્ન, ચૌદ વર્ષનો કઠિન વનવાસ, રાવણ સાથે લડાઈ, વર્ગેરે બધું વર્ણન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે. આ ગ્રંથ દ્વારા કુટુંબભાવના, સંયમ, સદાચાર, અક્રિત, સેવા, નભના, દ્વારા, વર્ગેરે ગુણોને પોષણ મળે છે. એટલે રામની જીવનકથા ભારતના ઘર ઘરની કથા બની ગઈ છે. દરેકને પોતાના ઘરમાં રામની જેમ સ્નેહ અને સમજણથી, દ્વારા અને સેવાથી, ક્ષમા અને મમતાથી જીવનાની ઈચ્છા રહે છે.

વાલ્મીકિના રામાયણ ઉપરથી બીજા ઘણાં ગ્રંથો રામના જીવન વિષે લખાયા છે જેમાં સંત શ્રી તુલસીદાસજીનું "રામચરિત માનસ" વધુ જાણીતું અને લોકપ્રિય છે. આ ગ્રંથો વાંચવાથી જીવનમાં અક્રિત, સદાચાર, કુટુંબ ભાવના વર્ગેરે ગુણો કંળવવાની પ્રેરણ મળે છે.

UNDER LINED

WORD
BANK

Lesson 5 : Location Pointers - પાઠ ૫ : સ્થાન નિર્દેશક

દાદાની આગળ મેહુલ ચાલે છે.

front

દાદાની પાછળ કૂતરો ચાલે છે

back

મેહુલની પાછળ દાદા ચાલે છે


back

દાદા કૂતરાની આગળ ચાલે છે

front


દાદા મેહુલ અને કૂતરાની વચ્ચે ચાલે છે

middle



Write Gujarati sentences from above:

Note : - Notice that the noun or pronoun related to top, under etc ends with ની



ટેબલની ઉપર કૂલદાની છે.

ટેબલની ઉપર બુક અને જગ છે.

ટેબલની નીચે બિલાડી છે.

ટેબલની નીચે કચરા પેટી છે.

Write these opposite pointers:-

ઉપર	નીચે
પાછળ	આગળ
નીચે	ઉપર
જમણે	બહાર
બહાર	જમણે
પેટું	ફાંદું

Write Gujarati sentences from above:

આ ઝાડ નદીની નજીક છે.

this near

પેલો પર્વત ઘરથી દૂર છે.

that far

આ ઝાડ ઘરની પાસે જ છે.

this near

તે પર્વત નદીને સામે કિનારે છે.

that opposite

આ ઘરની બંને બાજુ ઝાડ છે.

this both sides


ઘરની આગળ ઝાડ છે અને પાછળ પણ ઝાડ છે.

front

back



Write Gujarati sentences from above:



તેજલની જમણી બાજુ ખુરશી છે.

right side

મારી જમણી બાજુ ખુરશી છે.

right side

તારી ડાબી બાજુ ખુરશી છે.

left side

તેજલની ડાબી બાજુ ટેબલ છે.

left side

મારી ડાબી બાજુ ટેબલ છે.

left side

તારી જમણી બાજુ ટેબલ છે.

right side

Write Gujarati sentences from above:

Riddle and Fun time :

Speak these lines loudly a few times and solve the riddle:

કીડીની એક આગળ કીડી

કીડીની એક પાછળ કીડી

આગળ કીડી, પાછળ કીડી

કહો કેટલી ચાલતી કીડી?

તાડની અંદર ધર છે.

inside

તાડની બહાર જાડ છે

outside

તાડની નજીક છોકરો છે.

near

તાડની નીચે છોકરો રમે છે.

under

તાડની ઉપર પંખી ઊડ છે.

top



Note :- Notice that the noun or pronoun related to top, under etc ends with ની

Write Gujarati sentences from above:

૧

૨

૩

પાદ પછી બે આવે

after

ત્રણની પહેલાં એક આવે

before

ત્રણને ત્રણની પહેલાં એક આવે

before

ત્રણ એક અને ત્રણની વચ્ચે આવે

middle



પાંજરાની અંદર પોપટ છે

inside

પાંજરાની બહાર બિલાડી છે.

outside

બિલાડી પોપટ સામે જુઓ છે.

at

Write Gujarati sentences from above:

Write these "opposite pointers":-

અંદર

દૂર

બહાર

પાછળ

નજીક

નીચે

નામ

જમણે

નાડ

બહાર

નાડ

પણ

ઉંદરોની સભા

ઉંદરો બધા રમતા હતા. કૂદતા, ઉછળતા, એકબીજાને નચાવતા હતા. હસાહસી કરતા પકડાપકડી રમતા હતા. ખૂબ ધમાધમ કરતા હતા. કેટલાક ગુલાંટ ખાતાં ખાતાં ચિચિયારી બોલાવતા હતા. નાના-મોટા બધા ઉંદરો આનંદમાં રમતા હતા.

“એ..એ..એએ... ભાગો! બિલાડી આવી, ભાગો!!” એક નાની ઉંદરડીએ ચીસ પાડી. અને એક જ ક્ષણમાં ઉંદરોનું મંડળ છૂટું પડી ગયું. બધા ઉંદરો જુદી જુદી દિશામાં દોડી ગયા, અહીં તહીં સંતાઈ ગયા. ફેરો ફોગટ ગયો છતાં પણ બિલાડી ગૌરવથી ચાલી ગઈ.

થોડી વાર પછી એક એક કરીને ઉંદરો દરમાં ભેગા થયા. ગૂસપૂસ ચાલી. ગણગણાટ થયો. વાતો વધી.

“આ તે કેમ ચાલે? આ બિલાડી કાયમ આપણે આનંદ બગાડે છે.”

“ગમે ત્યાંથી આવી ચડે છે અને આપણાને ડરાવે, હુંફાવે છે!”

“એનાથી કેમ બચવું? આપણે કાયમ ભાગતા ફરીએ તે કેમ ચાલે?”

“અને કેમ કરીને હરાવવી?”

“કાંઈક તો ઉપાય કરવો જોઈએ જેથી આપણે શાંતિથી રહી શકીએ.”

બધા ઉંદરો બોલતા હતા. બિલાડીને કેમ કરીને છેતરવી? બિલાડીથી કેમ બચવું? ... વારાફરતી ઉંદરો જુદા જુદા ઉપાયો રજૂ કરતા હતા. પરંતુ એકે ઉપાય બંધ બેસતો થયો નહિ. દરેકમાં કાંઈક ને કાંઈક ખામી હતી.

“બિલાડીને ગળે ઘંટ બાંધીએ તો?” એક ચુવાન ઉંદર ડહાપણથી બોલ્યો. “એ બિલાડી આવે તે વખતે ઘંટડી રણકે ! ઘંટડીનો અવાજ આવે કે તરત આપણે ભાગી જવાનું! પછી એ ફાવે જ શાની?”

“વાહ વાહ!” “સાચી વાત!” “સરસ ઉપાય!” “આખરે બિલાડી ઉપર જુત!” બધા ઉંદરોને ઉપાય ખૂબ જ ગમી ગયો. આનંદ આનંદ છવાઈ ગયો.

“પણ...” એક ઘરડો ઉંદર કહેવા ગયો, પણ બીજા ઉંદરોના અવાજથી દબાઈ ગયો. ફરી તે મોટેથી બોલ્યો : “આ ઉપાય તો બરાબર, તેમાં શંકા નથી. પણ તે બિલાડીના ગળામાં ઘંટ બાંધવો કર્ય રીતે? અને કયો ઉંદર બિલાડીના ગળામાં ઘંટ બાંધશે?”

આ સાંભળી ઉંદરો ચૂપ થઈ ગયા. ઉંદરોને સમજાયું કે બોલવું જોટલું સહેલું જણાય, પણ કરવું તેટલું સહેલું નથી! કરવું અધરોં છે ! તે દિવસથી કહેવત છે કે :

“બિલાડીને ગળે ઘંટ કોણ બાંધશે ?”





ત્યાં ભગવાન રહે

એક સંત હતા.

ગામ બહાર નાનકડી ઝૂંપડીમાં તે રહેતા. ઝૂંપડી ઝાડનાં પાંડાં, ડાળખાં ને ઘાસમાંથી બનાવેલી. એટલી નાની કે માંડ એક જ વ્યક્તિ રહી શકે એટલી એ ઝૂંપડીમાં જગા.

એક દિવસે ખૂબ વરસાદ પડતો હતો. પેલા સંત ઝૂંપડીમાં સૂતા સૂતા ભગવાનનું સ્મરણ કરતા હતા. એ વખતે બારણે ટકોરા પડ્યા. સંતે બારણું ખોલ્યું. કોઈ અજાણ્યો માણસ ભીંજાયેલા કપડે ઊભો હતો. કહે : “મને અંદર રહેવા દેશો ?” સંતે કહ્યું, “પદ્મારો, ભીંજાયેલી ઝૂંપડીમાં એક માણસને સૂવાની જગા છે, પણ આપણે બંને પ્રેમથી બેસી શકીશું.”

પેલો અજાણ્યો માણસ પણ ભક્ત હતો. બન્ને ઝૂંપડીમાં બેસીને પ્રભુસ્મરણ કરવા લાગ્યા. થોડો વખત વીત્યો ત્યાં ફરીથી કોઈએ બારણું ખટખટાવ્યું. સંતે બારણું ઉધાડીને જોયું તો કોઈ ભીંજાયેલો માણસ જણાયો. “બહાર બહુ વરસાદ છે, મને અંદર આવવા દેશો ?” ધૂજતા અવાજે તેણે પૂછ્યું. પેલા સંત બોલ્યા, ‘આવો, ઝૂંપડીમાં બે જણ માટે બેસવાની જગા છે, તો આપણે પ્રણ જણા ખુશીથી ઊભા રહી શકીશું.’’

ત્રીજી વ્યક્તિ પણ સંત હતી. અણે જણાએ ઊભા રહીને ભગવાનનું સ્મરણ કરવા માંડ્યું.

સૌની આંખો બંધ હતી, પણ તેમને લાગ્યું કે કોઈ ચોથો માણસ પણ એમની સાથે છે. તેમણે આંખો ઉધાડીને જોયું તો સ્વયં ભગવાન તેમની પાસે જ ઊભા હતા ! ત્રીજોએ ભગવાનને પ્રણામ કર્યા. “પ્રભુ, આપ અહીં !” ત્રીજો ખસીને જગ્યા કરવા લાગ્યા. પણ જગ્યા જ કચાં હતી !

ભગવાન હસ્યા. બોલ્યા, “સંતો, તમે એટલા હળીમળીને રહ્યા છો કે મને આ ઝૂંપડી જ મારું ઘર લાગે છે. જ્યાં જ્યાં મને આવો સંપ અને સુમેળ દેખાય છે ત્યાં જ હું રહું છું.”

